



જનસંપર્ક અધિકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૨/૧૧/૨૦૧૮ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૧૪૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૮ કેસ કરી, ૩૬ વ્યક્તિઓને ઝડપી, ૨૦૮ લીટર દેશી દારૂ, ૩૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૦ બિયર ટીન, ૧ રિક્ષા અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૮,૩૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યાં હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૧૪૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૮૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૯ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપિંડી :-

સમાચાર યાદી નં.૨૧૪૩/૧૮

ગાયકવાડ હવેલી: સુગ્રાબીબી વા/ઓ મુસ્તુફામભાઈ મલેક (ઉ.વ.૫૫) (રહે.મટવા ઝુમ્મા મસિજદ નાના દરવાજા કલોલ જિલ્લો- ગાંધીનગર) પોતાના પતિની સારવાર કરાવવા વા.સા.હોસ્પિટલ ખાતે આવ્યા હતા દરમ્યાન વા.સા.હોસ્પિટલમાં ૪૫ વર્ષના આશરાના પુરૂષે મદદરૂપ થવા વિશ્વાસ કેળવી દવાનું બીલ ઓછું કરાવવા મારે મોટા સાહેબની ઓળખાણ છે, સાહેબ પાસે જવું પડશે તેમ કહી સુગ્રાબીબી મલેકને સમજાવી સાહેબ પાસે જવાનું નક્કી કરી તા.૧/૧૧/૧૮ સાજના ૭/૫૦ વાગ્યાના સુમારે જમાલપુર સોમનાથ ભુદરના આરા ચાર રસ્તા લઈ જઈ તેમની પાસેનું પાકીટ રૂમાલમાં મુકાવી રૂમાલમાં વીટીને તેની મોટર સાઇકલની ડેકીમાં મુકી સુગ્રાબીબીબે શાકમાર્કેટ તરફ ચાલતા લઈ ગયેલ અને શાકમાર્કેટના ગેટ નં.૩ નજીક હુ સાહેબને મળી આવું તેમ કહી સુગ્રાબીબીબીને ઉભા રાખી પલાયન થઈ ગયો હતો. જે પાકીટમાં રોકડ રૂપિયા ૧૩,૦૦૦/- હતા જે લઈ જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ અંગેની ફરીયાદ સુગ્રાબીબી મલેકે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.પી.ચૌહાણ ચલાવે છે.

સોલા હાઈકોર્ટ: સેજલબહેન હર્ષીલભાઈ પટેલ (રહે. સીમંધર હોમ્સ વંદેમાતરમ સીટી પાછળ ગોતા) એ તા.૦૧/૧૧/૧૮ નારોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૦૪/૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન અજાણી વ્યક્તિએ [jmspicencr@gmail.com](mailto:jmspicencr@gmail.com) મેઈલ આઈડીથી મેઈલ કરી સેજલબહેન પાસેથી ૫ ટન જીરૂ કિમત રૂપિયા ૮,૮૭,૨૫૦/- ખરીદી કરી જે પૈકી રૂપિયા ૨,૭૦,૦૦૦/- સેજલબહેનના ખાતામાં જમાં કરાવી બાકી નિકળતા રૂપિયા ૬,૧૭,૨૫૦/- નહી ચુકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.ડી.પટેલ ચલાવે છે.

**ઓઢવ:** બઢદેવભાઈ જીવણભાઈ રબારી ઉ.વ.૪૧ રહે- શ્રીનાથ સોસાયટી પંડીતજી હોટલ પાસે નાના ચિલોડા નરોડા) ઁ તા.૦૧/૧૧/૧૮ નારોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે આરોપી (૧) મહાદેવભાઈ ખેંગારભાઈ ભરવાડ (૨) સકતાભાઈ ભગાભાઈ ભરવાડ (બંન્ને રહે. ઓઢવની ટી.પી.નં-૧ ઉપર આવેલ ફાઇનલ પ્લોટ નં-૧૯૯.૨૦૧.૨૦૪. ઇંદીરાનગર વસાહતના કાયા છાપરામાં ઓઢવ) ઁ ભેગા મળી બઢદેવભાઈ રબારીની કંપનીને મળેલ પ્રોજેક્ટ કાયા મકાન ધારકોને પાકા મકાનો મળી રહે તે માટે ફોર્મ વિતરણ તેમજ કામ ચલાઉ અન્ય જગ્યાઁ વસવાટ માટે ઁડવાન્સ ભાડાના ચેકનુ વિતરણ કરવામાં આવેલ તેથી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કાયા મકાન ધરાવતા હોય તેઓઁ બઢદેવભાઈની કંપની પાસેથી પાકા મકાનનું ફોર્મ ભરી પાકા મકાન માટે સભ્ય તરીકે જોડાયેલ હોવા છતા તેમજ તેઓને પાકુ મકાન ન મળે ત્યાં સુધી અન્ય જગ્યાઁ કામ ચલાઉ વસવાટ માટે કંપની પાસેથી કુલ રૂપિયા ૧,૪૪,૦૦૦/- ભાડા પેટે મેળવી લઈ કંપનીને નહી આપી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી આર.જી.જાડેજા ચલાવે છે.

**ધરફોડ:-**

**સમાચાર યાદી નં.૨૧૪૪/૧૮**

**પાલડી:** ટીવ્યાંગ આલોક ભટનાગર (રહે, સ્વરીત ઁપાર્ટમેંટ ટોરેન્ટ પાવરની બાજુમા સોનલ સીનેમા રોડ વેજલપુર) ઁ પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૩૧/૧૦/૧૮ સાજના ૬/૦૦ થી તા.૦૧/૧૧/૧૮ કલાક ૯/૪૫ સુધીના સમયગાળા દરમ્યાન પાલડી પી.ટી.કોલેજ રોડ કોમલ ઁક્લેવની બાજુમા સુવીધા બંગ્લોઝ ખાતે આવેલ “સાથ” બચત અને ધીરાણ સહકારી મંડળીની ઓફીસના દરવાજાનો નકુચો તોડી અજાણી વ્યક્તિ ઓફીસમાં પ્રવેશ કરી, ઓફીસના બે લોકર તોડી રોકડ રૂપિયા ૧,૮૫,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી બી.ઁસ.રબારી ચલાવે છે.

**આત્મહત્યા:-**

**સમાચાર યાદી નં.૨૧૪૫/૧૮**

**સાબરમતી:** અંકિત કનૈયાલાલ પંચાલ (ઉ.વ.૩૬) (રહે. પંચાલ નિવાસ જૈન દેરાસર સામે રામનગર સાબરમતી) ઁ અગમ્ય કારણસર તા.૩૧/૧૦/૧૮ રાતના ૧૧/૦૫ વાગ્યા પહેલા પોતાના ઘરે લોખંડના કડા સાથે દુપટ્ટે બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી શનાભાઈ ધુળાભાઈ ચલાવે છે.

**કૃષ્ણનગર:** જીગીશાબહેન નીતીનભાઈ યુનારા (ઉ.વ.૩૦) (રહે. પ્રભાકર સોસાયટી જી.ડી.રોડ સૈજપુર) ઁ અગમ્ય કારણસર તા.૦૧/૧૧/૧૮ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટે બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ભગવાનભાઈ લક્ષ્મણભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.